

લેખકોની નાગરિકોને અપીલ:

ચાલો આપણે નફરતના રાજકારણની વિરુદ્ધમાં મત આપીએ; આપણે સમાન અને વૈવિધ્ય-સભર ભારત માટે મત આપીએ.

આવી રહેલી ચૂંટણીઓએ આપણા દેશને એક ચોરાહા પર ઊભો કર્યો છે. આપણા બંધારણે બધા જ નાગરિકોને સમાન અધિકારોની, તેઓ ઈચ્છે એ ખાવાના, ધર્મ પાળવાના અને જીવવાના સ્વાતંત્ર્યની તેમ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અસમ્મત થવાના હક્કની બાહેધરી આપી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે નાગરિકોને તેમના સમૂહ, જ્ઞાતિ કે લિંગને કારણે અથવા તો એ અમૂક પ્રદેશોમાથી આવતા હોવાથી અમૂક સમૂહ દ્વારા કાયદો પોતાના હાથમાં લઈને મારી નાખવામાં કે એમના પર હુમલો કરવામાં કે એમના પ્રતિ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. દેશને વિભાજિત કરવા, ભય પેદા કરવા કે વધુ અને વધુ લોકોને પૂરા અધિકાર સાથે જીવતા નાગરિકોમાથી બાકાત કરવા માટે નફરતના રાજકારણનો ઉપયોગ થાય છે. લેખકો, કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, સંગીતકારો અને બીજા સાંસ્કૃતિક તજજ્ઞોનો પીછો કરવો, તેમને ડરાવવા કે તેમના પર દેખરેખ રાખી નિયંત્રણ મૂકવામાં આવે છે. જે કોઈ સત્તાધારીઓને પ્રશ્ન પૂછે છે એને જુઠા અને હાસ્યાસ્પદ આરોપ મૂકી સતાવવામાં કે એની ધરપકડ કરવામાં આવે છે

આપણે બધાં આ પરિસ્થિતિ બદલાય એમ ઈચ્છીએ છીએ.

રેશનાલિસ્ટો, લેખકો અને કર્મશીલોનો પીછો થાય કે એમની હત્યા થાય એ આપણે નથી જોઈતું. સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમોની સામે શબ્દ કે કૃત્ય દ્વારા હિંસાની સામે સખત પગલાં લેવાય એ આપણે જોઈએ છે. આપણે નોકરી, શિક્ષણ, સંશોધન અને સ્વાસ્થ્ય માટે સંસાધનો ઊભાં થાય અને પગલાં લેવાય તેમ જ બધાંને સમાન તકો મળે એવું ઈચ્છીએ છીએ. ખાસ તો, આપણે આપણી વિવિધતાનું રક્ષણ કરવા અને લોકશાહીને સમૃદ્ધ કરવા માંગીએ છીએ.

આ આપણે કેવી રીતે કરી શકીએ? જે બદલાવ ખૂબ અગત્યનો ને જરૂરી છે એ આપણે કેવી રીતે લાવી શકીએ? ઘણી વસ્તુઓ આપણે કરવી જોઈએ અને કરી શકીએ. પણ તાકીદનું પહેલું પગલું આપણે લઈએ.

પહેલું પગલું, જે આપણે તરત લઈ શકીએ તે એ છે કે નફરતના રાજકારણને, આપણા લોકોના વિભાજન ને, અસમાનતા ને મતોથી હરાવીએ; હિંસા, ભય અને નિયંત્રણની વિરુદ્ધ મત આપીએ. આ એક માત્ર રસ્તે આપણે એ ભારતને મત આપીએ જે બંધારણે આપેલા વચનને ફરીથી જીવતું કરશે. આથી અમે બધાં જ નાગરિકોને વિવિધ અને સમાન ભારત માટે મત આપવાની અપીલ - વિનંતી કરીએ છીએ.